



# Bharat Parenterals Limited

Registered Office & Works:

Survey No.: 144-A, Jarod-Samlaya Road, Vill. Haripura,  
Ta. Savli, Dist. Vadodara - 391520 (Guj.) India.

Mobile : 99099 28332

E-mail: info@bplindia.in, Web.: www.bplindia.in

CIN NO: L24231GJ1992PLC018237

(WHO-GMP CERTIFIED ★ STAR EXPORT HOUSE)

Date: 04<sup>th</sup> September, 2023

To,  
BSE Limited  
Phiroze Jeejeebhoy Towers,  
Dalal Street, Fort,  
Mumbai -400 001

Scrip Code: 541096

Dear Sir / Madam,

**Sub: Intimation under Regulation 30 of SEBI (Listing Obligations and Disclosure Requirements) Regulations, 2015**

Pursuant to Regulation 30 of the SEBI (Listing Obligations and Disclosure Requirements) Regulations, 2015, we enclose herewith a copy of the Notice of 30<sup>th</sup> Annual General Meeting ('AGM') of the Company to be held through Video Conferencing ("VC") and Other Audio-Visual Means ("OAVM"), published in English and Vernacular language (Gujarati) newspaper in Business Standard and Loksatta Jansatta respectively for registration of E-Mail ID of the shareholders.

The copies of the same are enclosed herewith for your information and records.

**For Bharat Parenterals Limited**

**Shyam Rajpurohit**  
Company Secretary









**Union Bank**  
Sahabapur Branch  
3/2239, Pipardi Sheri, Sahabapura Main Road Surat  
Email: ubin0531120@unionbankofindia.com, Tele : 8369441250, 9372131120  
**DEMAND NOTICE UNDER SEC.13 (2)**  
Place : Surat Date : 31-08-2023  
To,  
**Mr. Dhiraakumar Ashvinkumar Mishra (Applicant)**  
**B 301, Suman Sankalp Society, Subham Residency, Godadara, Surat, 395010**  
**Mr. Binod Upadhyay (Guarantor)**  
**B 502, Suman Sankalp Society, Subham Residency, Godadara, Surat, 395010**  
Sir/Madam,  
SUB: Enforcement of Security Interest Action Notice -In connection with the credit facilities enjoyed by you with us - Classified as NPA  
We have to inform you that your account/accounts namely, **Mr. Dhiraakumar Ashvinkumar Mishra** have availed the following credit facilities from our Branch

Type of Facility	Account Number	Limit Sanctioned (in Rs.)	Exiting ROI
Term/Housing Loan	311206650000204	6,70,000.00	9.95 %

Further, we have to inform you that your accounts namely, **Mr. Dhiraakumar Ashvinkumar Mishra** have been classified as NPA account as on 29-08-2023 pursuant to your default in making repayment of dues/installment/interest. As on 31-08-2023, a sum of **Rs. 7,17,498.61 (Rupees Seven Lacs Seventeen Thousands Four Hundred Ninety Eight Rupees and Sixty One Paise)** is outstanding in your accounts as shown below:

Particulars	Amount (in Rs.)
<b>Term/Housing (Loan A/C No. 311206650000204)</b>	
Outstanding Balance as per extract from ledger showing balance as on date of NPA, i.e., 29-08-2023 (inclusive of interest charged up to 30-04-2023).	<b>6,99,572.81</b>
Un-applied Interest from 01-05-2023 to 30-07-2023	<b>17,925.80</b>
Penal Interest from 01-05-2023 to 30-07-2023	<b>0.00</b>
Total outstanding dues as on 31-01-2023	<b>7,17,498.61</b>

In spite of our repeated demands, you being the borrowers and mortgagors, failed to pay total amount towards the amount outstanding in the loan accounts and neglected and defaulted to discharge the contractual liabilities.  
We do hereby call upon you in terms of section 13(2) of the Securitization and Reconstruction of Financial Assets and Enforcement of Security Interest Act, 2002, to pay a sum of **Rs. 7,17,498.61 (Rupees Seven Lacs Seventeen Thousand Four Hundred Ninety Eight and Sixty One Paise only)** together with unrecovered interest (if any), cost & expenses and future interest from **31-07-2023** at the contractual rate as per the terms and conditions of loan documents executed by you and discharge your liabilities in full within 60 days from the date of receipt of this notice, failing which, we shall be constrained to enforce the following securities created by you in favour of the bank by exercising any or all of the rights given under the said Act.  
**DETAILS OF THE SECURED ASSETS:**  
All the right, title and interest in the immovable property bearing Flat no LIG-30/B-301, admeasuring carpet area 35.119 sq.mtrs. and admeasuring built up area 41,301 sq.mtrs. the 3rd floor of building No. "B" along with leased hold rights in the land of G.H.B's estate known as "SUMAN SANKALP" Of Gujarat Housing Board - LIG' constructed on the land Bearing T.P. Scheme No. 61 (Godadara) F.P. No. 227 of Village: Godadara, Taluka: Surat City, District: Surat. Owned by: Mr. Dhiraakumar Ashvinkumar Mishra  
1] Please note that if you fail to remit the dues within 60 days and if Bank exercises all its rights under this Act and if the dues are not fully satisfied with the sale of proceeds of the secured assets, we shall be constrained to take appropriate legal action against you in a court of law / Debt Recovery Tribunal for recovery of the balance amount from you.  
2] As per sec.13 (13) of the Act, on receipt of this notice you are restrained from disposing of or dealing with the above securities except in the usual course of business without the consent of the Bank. Please note any violation of this section entails serious consequences.  
3] Your kind attention is invited to provisions of sub-section (8) of Section 13 of the SARFAESI in respect of time available, to redeem the secured assets.  
Date - 31.08.2023 Yours Faithfully,  
Place - Surat (Rahul Kumar) Chief Manager, Authorized Officer

**DEEP INDUSTRIES LIMITED**  
CIN: L14282GJ2006PLC049371  
REGI. OFFICE: 12A &14, Abhishek Corporate Park, Ambli Bopal Road, Ambli, Ahmedabad - 380058 Ph.: 02717-298510 Fax: 02717-298520, E-mail: cs@deepindustries.com website: www.deepindustries.com

**NOTICE TO THE SHAREHOLDERS FOR 17<sup>TH</sup> ANNUAL GENERAL MEETING, E-VOTING, RECORD DATE FOR FINAL DIVIDEND AND BOOK CLOSURE**

1. Notice is hereby given that the 17<sup>th</sup> Annual General Meeting (AGM) of the Deep Industries Limited ("the Company") will be held on Monday, September 25, 2023 at 11:00 am IST through Video Conference (VC)/Other Audio Visual Means (OAVM) in accordance with the applicable provisions of the Companies Act, 2013 and in compliance with applicable circulars issued by the Ministry of Corporate Affairs and Securities Exchange Board of India, to transact the businesses set out in the Notice calling the AGM without presence of members at a common venue. The Company has sent the Notice of the AGM along with the Annual Report for the financial year ended on March 31, 2023 on Saturday, September 02, 2023 through electronic mode only to those members whose e-mail address are registered with the Company and/or Depositories as on August 25, 2023. The requirement of sending physical copies of the Notice of the AGM has been dispensed with vide MCA Circulars for General Meetings and SEBI Circulars for General Meetings. Any members, who wish to obtain hard copy of Annual Report, may write to the Company for the same.
2. The Annual Report for the financial year ended on March 31, 2023, inter-alia containing the Notice convening the 17<sup>th</sup> AGM and the Explanatory Statement are also available on the website of Company at [www.deepindustries.com](http://www.deepindustries.com), website of the Stock Exchanges i.e. BSE Limited and National Stock Exchange of India Limited at [www.bseindia.com](http://www.bseindia.com) and [www.nseindia.com](http://www.nseindia.com), Link Intime India Private Limited at [www.instavote.linkintime.co.in](http://www.instavote.linkintime.co.in) respectively. The documents referred to the notice of the AGM are available electronically for inspection by the Members from the date of circulation of the Notice of the AGM. Members seeking to inspect such documents can send an email to [cs@deepindustries.com](mailto:cs@deepindustries.com).
3. As per the Section 108 of the Companies Act, 2013 read with Rule 20 of the Companies (Management and Administration) Rules, 2014 and Regulation 44 of SEBI (LDDR) Regulations, 2015, the Company is providing its members the facilities to cast their vote by 'Remote e-voting' and also 'venue e-voting' at the time of AGM on all the resolutions set forth in the Notice of the 17<sup>th</sup> AGM. The Company has engaged the services of Link Intime India Private Limited ('LIIPL') as the agency to provide e-voting facility.
4. Members holding shares either in physical mode or in dematerialized mode as on Monday, September 18, 2023, being the cut-off date, may cast their vote electronically on the business as set forth in the Notice of the AGM through electronic voting system of LIIPL. All members of the Company are informed that:-  
a. The remote e-voting will commence at 9:00 a.m (IST) on Friday, September 22, 2023.  
b. The remote e-voting shall end at 5:00 p.m (IST) on Sunday, September 24, 2023.  
c. E-voting module shall be disabled after 5:00 p.m (IST) on Sunday, September 24, 2023.  
d. The Register of Members and Share Transfer Books of the Company will remain closed for the purpose of AGM from Tuesday, September 19, 2023 to Monday, September 25, 2023 (both days inclusive).  
e. A person who has acquired the shares and has become a member of the Company after the dispatch of the Notice of the AGM and prior to the Cut-off date i.e. Monday, September 18, 2023, shall be entitled to exercise his/her vote either electronically i.e. remote e-voting or e-voting system on the date of the AGM by following the procedure mentioned in the notice of AGM.  
f. The Members may note that only those Members, who will be present in the AGM through VC / OAVM and have not cast their vote on the Resolutions through remote e-voting and are otherwise not barred from doing so, shall be eligible to vote through e-voting system available during the 17<sup>th</sup>AGM. Members who have cast their vote through remote e-voting will be eligible to attend the AGM. However, they will not be eligible to vote at the AGM.  
g. In case shareholders/ members have any queries regarding login/ e-voting, they may send an email to [instameet@linkintime.co.in](mailto:instameet@linkintime.co.in) or contact on: - Tel: 022-49186175.  
h. The Company has appointed Mr. Ravi Kapoor, Proprietor of M/s. Ravi Kapoor & Associates, Practicing Company Secretaries as the Scrutinizer.
- i. **Manner of registering/updating e-mail address:**  
i. Members holding shares in physical mode, who have not registered/ updated their e-mail address with the Company, are requested to register/ update their e-mail address by submitting Form ISR-1 duly filed and signed along with requisite supporting documents to the Company/Registrar and Transfer Agent i.e. Link Intime India Private Limited at 5th Floor, 506 to 508, Amarnath Business Centre-1 (ABC-1), Besides Gala Business Centre, Near St. Xavier's College Corner, Off C. G. Road, Ellisbridge, Ahmedabad - 380006  
ii. Members holding shares in dematerialized mode, who have not registered/updated their e-mail address are requested to register/update their e-mail address with Depository Participant(s) where they maintain their demat accounts.
- j. **Payment of Dividend and Tax Deducted at Source (TDS):**  
i. Board of Directors at their meeting held on May 27, 2023 has recommended Final Dividend of Rs. 1.85 i.e. 37% on the face value of Rs. 5/- per equity share for the year ended on March 31, 2023 subject to the approval of the Members' at the 17<sup>th</sup> Annual General Meeting (AGM) of the Company.  
ii. The record date for the purpose of determining entitlement of members for receiving dividend for the financial year ended on March 31, 2023 is Monday, September 18, 2023.  
iii. The Company had sent an e-mail on September 02, 2023 to all the shareholders whose e-mail addresses were registered with RTA / Depository on August 25, 2023 intimating the detailed communication of TDS on Dividend and documents/declaration to be submitted in due time line mentioned in the said communication.  
By Order of the Board  
For Deep Industries Limited  
Sd/-  
Place: Ahmedabad Shilpa Sharma  
Date: September 04, 2023 Company Secretary and Compliance Officer

**ATN INTERNATIONAL LIMITED**  
CIN : L65993WB1983PLC080793  
Regd. Office : 10 Princep Street, 2nd Floor, Kolkata - 700072  
Email : [atninternationallimited@gmail.com](mailto:atninternationallimited@gmail.com), website : [www.atninternational.in](http://www.atninternational.in)  
Phone : 91-33-4002 2880, Fax : 91-33-2237 9053  
**NOTICE OF 39th ANNUAL GENERAL MEETING (AGM), E-VOTING INFORMATION AND BOOK CLOSURE**  
Notice is hereby given that:  
1. The 39<sup>th</sup> (Thirty-Ninth) Annual General Meeting (AGM) of Members of the Company will be held on Monday, the 25th day of September, 2023 at 2:00 PM. (IST) through Video Conferencing ("VC")/ Other Audio Visual Means ("OAVM"), in compliance with applicable provisions of Companies Act, 2013 and rules made there under, SEBI (Listing Obligations and Disclosure Requirements) Regulations, 2015, the Secretarial Standard an General Meetings (SS-2) issued by Institute of Company Secretaries of India read 'with MCA's circular no. 10/2022 dated 28th December, 2022 and SEBI circular no. SEBI/HO/CFD/CMD2/C1/R/P/2022/62 dated 13th May, 2022.  
2. Members will be able to attend the meeting only through VC/OAVM and those members participating in the said AGM through VC/OAVM facility shall be reckoned for the purpose of quorum under Section 103 of the Companies Act, 2013.  
3. In Compliance with MCA Circulars and SEBI Circular, the Notice of 39th AGM including details and instructions for remote e-voting-e-voting at AGM and Financial Statements including Auditors' Report, Board's Report and related Annexures attached therewith (Collectively referred to as "Annual Report 2022-23" or "Annual Report") have been sent on 02.09.2023, in electronic mode, to all the members whose e-mail ids are registered with the Company's Registrar and Share Transfer Agents (RTA), M/s. Maheshwari Datamatics Pvt Ltd /their respective Depository Participant(s). This is also in accordance with the provisions of Section 101 of the Companies Act, 2013 read with Rule 18 of the Companies (Management & Administration) Rules, 2014 and Rule 11 of the Companies (Accounts) Rules, 2014. The same are also available on the website of the company at [www.atninternational.in](http://www.atninternational.in) and can also be accessed from the website of Bombay Stock Exchange at [www.bseindia.com](http://www.bseindia.com), National Stock Exchange at [www.nseindia.com](http://www.nseindia.com) and that of Calcutta Stock Exchange at [www.cse-india.com](http://www.cse-india.com)  
4. The Register of Members and Share Transfer Books of the Company shall remain closed from Tuesday, 19th day of September, 2023 to Monday, 25th day of September, 2023 (Both days Inclusive) for the purpose of Annual General Meeting. All members holding shares either in physical form or dematerialized form, as on the cut-off date, Monday, 18th September, 2023 are provided with the facility to cast their vote electronically (e-voting) on the business as set forth in the Notice of the 39th AGM, for which the company has engaged the services of Central Depository Services (India) Ltd as E-Voting agency. Members may cast their votes remotely (Remote-E-voting) or cast votes at the AGM (E-voting), using electronic system provided by CDSL. The facility to cast vote electronically at the AGM (E-voting) will be made available for members attending the AGM who have not cast their vote(s) by remote E-Voting.  
5. All the members are informed that  
a. The remote e-voting shall commence on Friday, 22nd September, 2023 at 9:00 A.M. (IST)  
b. The remote e-voting shall end on Sunday, 24th September, 2023 at 05:00 PM (IST).  
c. Remote E-voting will not be allowed beyond the aforesaid date and time and the Remote E-voting module shall be forthwith disabled by CDSL, upon expiry of the aforesaid period.  
6. The cut-off date for determining the eligibility to vote by electronic means and to attend the AGM is Monday, 18th September, 2023. Members who have cast vote(s) through Remote E-voting may attend the meeting but will not be entitled to cast their vote(s) at the AGM.  
7. Members may note that:  
a) Once the vote on a resolution is cast by the member, the member shall not be allowed to change it subsequently.  
b) The Company has appointed Mr. Atul Kumar Labh, Practicing Company Secretary as the Scrutinizer to scrutinize the voting process in a fair and transparent manner.  
ix. In case of any queries, you may refer the Frequently asked Question (FAQs) for Shareholders and e-voting manual available at [www.evotingindia.com](http://www.evotingindia.com) under help section or write an email to [helpdesk.evoting@cdslindia.com](mailto:helpdesk.evoting@cdslindia.com) or call on toll free no. 1800225533. Members may also write to the Company Secretary at the Company's email address [atninternationallimited@gmail.com](mailto:atninternationallimited@gmail.com).  
Place : Kolkata For ATN International Limited  
Date : 02.09.2023 Sd/- **Amitava Das**, Company Secretary

**Canara Bank**  
Varachha Branch, Ground floor, J.P. Bhavan, Mr. Jeevandhara Hotel, Dongrewadi road, Varachha road, Surat.  
**DEMAND NOTICE [SECTION 13(2)] TO BORROWER/ GUARANTOR/MORTGAGOR**  
Ref: CV/VRCH/311619000482 Date: 25.08.2023  
Maya Mukunnda Patil (Co Borrower And Legal Heir Of Late Mr. Mukunnda Namdev Patil) Plot No.236, Aarya Residency, Moje,Village-Kareli, Taluka - Palsana, Dist-Surat.

**Dear Sir,**  
Sub: Notice issued Under Section 13(2) of the Securitization & Reconstruction of Financial Assets & Enforcement of Security Interest Act, 2002.  
The undersigned being the Authorized Officer of Canara Bank, branch(hereinafter referred to as "the secured creditor"), appointed under the Securitization and Reconstruction of Financial Assets and Enforcement of Security Interest Act, 2002, (hereinafter referred as the "Act") do hereby issue this notice to you as under:  
That **Late Mr. Mukunnda Namdev Patil, Maya Mukunnda Patil** (hereinafter referred to as "the Borrower") has availed credit facility stated in the Schedule A hereunder and has entered into the security agreement/s in favour of the secured creditor. While availing the said financial assistance, you have expressly undertaken to repay the loan amount/s in accordance with the terms and conditions of the above mentioned agreements.  
That **Late Mr. Mukunnda Namdev Patil, Maya Mukunnda Patil** (hereinafter referred to as "the Guarantor") has guaranteed the payment on demand of all moneys and discharge all obligations and liabilities owing or incurred to the secured creditor by the Borrower for credit facilities up to the limit of **Rs.15,50,000.00 (Rupees Fifteen lakh fifty thousand Only)** with interest thereon.  
You are also entered into to agreements against the secured assets which are detailed in Schedule B hereunder.

**SCHEDULE B**  
Residential property situated at Plot no. 236 Aarya Residency, Moje/Vill - Kareli, Taluka - Palsana, Rev - block no.82, (Old Survey no.55) District.Surat. Bounded by: North: Plot No. 235, South: Plot No. 237, East: Plot No. 203, West: Society Internal Road. Name of the title holder: **Mukunnda Namdev Patil, Maya Mukunnda Patil**.  
However, from 24/12/2022 the operation and conduct of the said financial assistance/ credit facilities have become irregular. The books of account maintained by the secured assets shows that the liability of the Borrower towards the secured creditor as on 24/03/2023, amounts to **Rs. 15,12,634.05 (Rupees Fifteen lakh twelve thousand six hundred thirty four rupees and five Paise Only)**, + further Interest and charges thereon less recovery of the details of which together with future interest rate are stated in Schedule C hereunder. It is further stated that the Borrower/Guarantor having failed to keep up with the terms of the above said agreement in clearing the dues of the secured creditor within the time given, and have been evasive in settling the dues. The operation and conduct of the above said financial assistance/ credit facility lies having come to a standstill and as a consequence of the default committed in repayment of principal debt/ instalment and interest thereon, the secured creditor was constrained to classify the debt as Non-Performing Asset (NPA) as on 24/03/2023 in accordance with the directives/guidelines relating to asset classification issued by the Reserve Bank of India.  
The secured creditor through this notice brings to your attention that the Borrower has failed and neglected to repay the said dues/ outstanding liabilities and hence hereby demand you under Section 13(2) of the Act, by issuing this notice to discharge in full the liabilities of the Borrower as stated in Schedule C hereunder to the secured creditor within 60 days from the date of receipt of this notice. Further, it is brought to your notice that you are also liable to pay future interest at the rate of as mentioned in 'Schedule C per year together with all costs, charges, expenses and incidental expenses with respect to the proceedings undertaken by the secured creditor in recovering its dues.  
Please take note of the fact that if you fail to repay to the secured creditor the aforesaid sum of **Rs. 15,12,634.05 (Rupees Fifteen lakh twelve thousand six hundred thirty four rupees and five Paise Only)**, + further interest and charges thereon less recovery (as stated in schedule C) and incidental expenses and costs as stated above in terms of this notice under Section 13(2) of the Act, the secured creditor will exercise all or any of the rights detailed under sub-section (4) (a) and (b) of Section 13, the extract of which is given here below to convey the seriousness of this issue:  
13(4)- In case the Borrower/Guarantor fails to discharge liability in full within the period specified in sub-section (2), the secured creditor may take recourse to one or more of the following measures to recover his secured debt, namely;

- (A) Take possession of the secured assets of the Borrower/Guarantor including the right to transfer by way of lease, assignment or sale for realizing the secured asset;  
(B) Take over the management of the business of the Borrower including the right to transfer by way of lease, assignment or sale for realizing the secured asset;  
Provided that the right to transfer by way of lease, assignment or sale shall be exercised only where the substantial part of the business of the Borrower is held as security for the debt; Provided further that where the management of whole of the business or part of the business is severable, the secured creditor shall take over the management of such business of the borrower which is relatable to the security for the debt; and under other applicable provisions of the said Act.  
Your attention is invited to provisions of sub-section (8) of Section 13 of the Act, in respect of time available, to redeem the secured assets.  
You are also put on notice that in terms of section 13(13) the Borrower/Guarantor shall not transfer by way of sale, lease or otherwise the said secured assets detailed in Schedule B hereunder without obtaining written consent of the secured creditor. It is further brought to your notice that any contravention of this statutory injunction/ restraint, as provided under the said Act, is an offence and if, for any reason, the secured assets are sold or leased out in the ordinary course of business, the sale proceeds or income realized shall be deposited with the secured creditor. In this regard you shall have to render proper accounts of such realization/ income.

This notice of Demand is without prejudice to and shall not be construed as waiver of any, other rights or remedies which the secured Creditor may have including further demands for the sums found due and payable by you.  
This is without prejudice to any other rights available to the secured creditor under the Act and/or any other law in force.  
Please comply with the demand under this notice and avoid all unpleasantness. In case of Noncompliance, further remedial action will be resorted to, holding you liable for all costs and consequences.

**Thanking you**  
Date : 25/08/2023 Yours Faithfully, Authorized Officer

**Bharat Parenterals Limited**  
CIN NO: L24231GJ1992PLC018237  
Registered Office & Works:  
Vill. Hariपुरa, Ta. Savli, Dist. Vadodra - 391520 (Guj.) India.  
Tel : (02667)-251679, 251680, 251669, 99099 28332.  
E-mail: info@bplindia.in, Web: www.bplindia.in  
(WHO-GMP CERTIFIED \* STAR EXPORT HOUSE)  
**NOTICE**  
AGM of the Company will be held on September 30, 2023 at 10:30 A.M. through Video Conference ("VC") / Other Audio Visual Means ("OAVM") to transact the business, as set forth in the Notice.  
1. Ministry of Corporate Affairs ("MCA") vide its Circulars dated 28th December, 2022, read with Circulars May 5, 2022 and General Circular No. 02/2022 dated 05.05.2022 (collectively referred to as "MCA Circulars") permitted holding of the Annual General Meeting ("AGM") through Video Conferencing ("VC") / Other Audio-Visual Means ("OAVM"), without physical presence of the Members at a common venue. In compliance with the provisions of the Companies Act, 2013 ("Act"), SEBI (Listing Obligations and Disclosure Requirements) Regulations, 2015 ("SEBI Listing Regulations") and MCA Circulars, this AGM of the Company is being held through VC / OAVM.  
2. In accordance with the MCA Circulars and the SEBI Circulars the Notice of the AGM along with the Annual Report for the financial year 2022-23 will be sent only by electronic mode to those Members whose email addresses are registered with the Company/Depositories. These documents will also be available on the Company's website [www.bplindia.in](http://www.bplindia.in) & on website of the Stock Exchange i.e. BSE Limited at [www.bseindia.com](http://www.bseindia.com).  
3. Members can attend and participate in the AGM through VC/OAVM facility only. The instructions for joining the AGM will be provided in the Notice of the AGM. Members attending the meeting through VC/OAVM shall be counted for the purposes of reckoning the quorum under Section 103 of the Companies Act, 2013.  
4. The Company will be providing remote e-voting facility ("Remote e-voting") to all its Members to cast their votes on all resolutions set out in the Notice of the AGM as well as the facility of voting through e-voting system during the AGM. Detailed procedure for remote e-voting/ e-voting will be provided in the Notice of the AGM.  
5. The Physical Shareholders can register their mail id by sending a mail to [cs@bplindia.in](mailto:cs@bplindia.in) by providing the details of Folio No., Name of Shareholder, No. of shareholding and registered E-Mail ID. The shareholders who hold shares in dematerialised form can register their E-Mail Id with their Depository Participants (DP) where they have their demat account by complying with the requisite formalities.  
By order of the Board  
For Bharat Parenterals Limited  
Sd/-  
Shyam Rajpurohit  
Company Secretary  
Place : Vadodra  
Date : 04<sup>th</sup> September, 2023

**Bank of Baroda** S.g. Highway Branch, Zodiac Square, S.G.Highway, Opp Gurudwara Ahmedabad, Mo. No. 99784 46549 EMAIL : [ishaham@bankofbaroda.com](mailto:ishaham@bankofbaroda.com) Web : [www.bankofbaroda.com](http://www.bankofbaroda.com)  
**ANNEXURE - F - Revised [Terms and Conditions for Sale to be uploaded in Banks website as well as at IBAPI website]**  
**SALE NOTICE FOR SALE OF IMMOVABLE PROPERTIES**  
**E-Auction Sale Notice for Sale of Immovable Assets under the Securitisation and Reconstruction of Financial Assets and Enforcement of Security Interest Act, 2002 read with proviso to Rule 6 (2) & 8 (6) of the Security Interest (Enforcement) Rules, 2002.**  
Notice is hereby given to the public in general and in particular to the Borrower (s), Mortgagor (s) and Guarantor (s) that the below described immovable property mortgaged/charged to the Secured Creditor, possession of which has been taken by the Authorised Officer of Bank of Baroda, Secured Creditor, will be sold on "As is where is", "As is what is", and "Whatever there is" basis for recovery of dues in below mentioned accounts. The details of Borrower/s/Mortgagor/Guarantor/s/Secured Asset/s/Dues/Reserve Price/e-Auction date & Time, EMD and Bid Increase Amount are mentioned below -

No.	Name & address of Borrower/s / Guarantor/ s/ Mortgagor (s)	Detailed description of the immovable property with known encumbrances,if any	Total dues	Reserve Price, EMD and Bid increase amount
1	M/S. BARCKLY EXIM PRIVATE LIMITED (Borrower) Reg. Office : 214, 2nd Floor, Hari Krishna Complex, Pusthukunj Society, Near to Apsara Aradhna Cinema, Opposite- IOC, Petrol Pump, Maninagar, Dist- Ahmedabad, Gujarat, 380009 Shri Munafbai Mahmmadarif Vohra & Munafbai M Vohra (Director & Guarantor) Residence Address : 1/128, Vohrvad, Motorhi Station Road, Vadnagar, Mehsana, Gujarat, 384355	All that piece and parcel of property of lease hold plot no 08, having land admeasuring about 841.75 Sq Mt, of Vadnagar Sahakari Audyogik Vasahat Limited, situated on the Non agricultural land bearing survey no 2790 palki 1 of Moje Vadnagar, Taluka Vadnagar, Registration District Mehsana and Sub District Vadnagar in the name of Shri Munafbai Mahmmadarif Vohra, the said land is bounded as under: East- By wide road, West- By survey No 2783/ 1, North- By Plot no 9, South- By Plot no 7	Rs. 81,27,171.79	Reserve Price: Rs. 33,29,910/- EMD: Rs 3,32,991/- Bid Increase: Rs.50,000/-
2	Mrs. Laxmi Dilipbhai Chauhan 3 RUSHI COLONY BEHIND, KALUPUR BANK SANAND AHMEDABAD, GUJARAT-382110	All that Piece and Parcel of Immovable property being Block No. B (as per nagar Niyojak Plan Type-N) Flat No. B/104, 1st floor ( as per approved plan G.F. on H.P.), "Kesar City" Nr. Kesar Sapan, B/H Zydrus Research Center, Sarkhej Barva Highway, at Moraiya, Sanand Ahmedabad Boundaries North : Open Plot, South : Flat No B/109, East: Flat No. B/105, West : Stair	Rs. 6,86,814.38	Reserve Price: Rs. 7,56,060/- EMD: Rs 75,606/- Bid Increase: Rs. 10,000/-

**E-Auction Date: 25/09/2023 - 02:00 PM to 06:00 PM**  
**Status of possession : Physical | Inspection Date : 16/09/2023 - 10:00 AM to 01:00 PM**  
For detailed terms and conditions of sale, please refer to the link provided in <https://www.bankofbaroda.in/e-auction.htm> and <https://ibapi.in>. Also, prospective bidders may contact the authorized officer Mobile 9978446549.  
**AS PER SARFAESI ACT, STATUTORY 15- DAYS SALE NOTICE TO THE BORROWER/GUARANTOR/MORTGAGOR**  
The above mentioned borrower /s/ is/ are hereby notified to pay the sum as mentioned in section 13(2) Notice in full before the date of auction, failing which property will be auctioned / sold and balance dues if any will be recovered with interest and cost from borrowers/ guarantors /mortgagor.  
Date : - 02.09.2023, Place: - Ahmedabad  
Authorised Officer, Bank of Baroda

**IDFC First Bank Limited** (Formerly IDFC Bank Limited) | CIN : L65110TN2014PLC097792  
Registered Office : - KRM Towers, 7th Floor, Harrington Road, Chetpet, Chennai- 600031. Tel : +91 44 4564 4000 | Fax: +91 44 4564 4022  
AUTHORIZED OFFICER - MR. DHIRENDRA SINGH RATHORE | CONTACT NUMBER- 7014695647  
**APPENDIX- IV-A [See proviso to rule 8 (6)] SALE NOTICE FOR SALE OF IMMOVABLE PROPERTIES**  
E-Auction Sale Notice for Sale of Immovable Assets under the Securitisation and Reconstruction of Financial Assets and Enforcement of Security Interest Act, 2002 read with proviso to Rule 8 (6) of the Security Interest (Enforcement) Rules, 2002.  
Notice is hereby given to the public in general and in particular to the Borrower (s) and Co-Borrower (s) as per column (ii) that the below described immovable properties as per column (iii) mortgaged/charged to the Secured Creditor, the physical possession of which has been taken by the Authorised Officer of IDFC FIRST Bank Limited (Formerly IDFC Bank Limited), will be sold on "As is where is", "As is what is", and "Whatever there is" (on 10th Oct 2023 as described hereunder, for the recovery of amount due from Borrower (s) and Co-Borrower (s) as per column (i), due to IDFC FIRST Bank Limited (Formerly IDFC Bank Limited).

S. NO	(i) Demand Notice Amount	(ii) Name Borrower (s) and Co-Borrower (s)	(iii) PROPERTY ADDRESS	(iv) Reserve Price Amount	(v) EMD Amount	(vi) Date and Time of Auction	(vii) Date and Time of EMD Auction	(viii) Date and Time of Inspection
1	INR 12,84,835.43/- Demand Notice Date: 10th May 2021	Mrs. Pstaben D Jain & Mr. Dungalchand Babulalji Jain	All That Part And Parcel Of Immovable Property, Bearing Flat No. 202 Admeasuring Area 700 Sq.Fts. I.E. 65.03 Sq.Mtrs & Admeasuring 41.78 Sq.Mtrs Built Up Area, Second Floor, Building No. B/02, "Sweet House", Developed Upon And Situated In State Gujarat, District Surat, Sub-District & Taluka Surat City, Moje Village Kosad Bearing Revenue Survey Nos. 33/1 & 33/2, Block No. 51, T.P. Scheme No 23 (Kosad), Final Plot 4 Admeasuring 9986.00 Sq.Mtrs, N.A Land Paikae And Bounded:- East: Passage, West: Margin, North: Flat No. 203 & South: Flat No. 201	INR 12,60,000/-	INR 1,26,000/-	10th, Oct 2023 11 AM to 1 PM	9th, Oct 2023	3rd, Oct 2023 11 AM to 5 PM

For detailed terms and conditions of the sale, please refer to the link provided in [www.idfcfirstbank.com](http://www.idfcfirstbank.com).  
Disclaimer: Please note that the said notice is issued for sale of immovable property only and IDFC FIRST Bank Limited has no right to sale the movable assets, if any, present at the immovable property.  
Sd/-  
Authorised Officer  
IDFC FIRST Bank Limited  
(Formerly IDFC Bank Limited)  
Date: 04.09.2023

**IDFC First Bank Limited** (Formerly known as IDFC Bank Ltd) | CIN : L65110TN2014PLC097792  
Registered Office : - KRM Towers, 7th Floor, Harrington Road, Chetpet, Chennai- 600031. Tel : +91 44 4564 4000 | Fax: +91 44 4564 4022  
**APPENDIX- IV-A [See proviso to rule 8 (6)] SALE NOTICE FOR SALE OF IMMOVABLE PROPERTIES**  
E-Auction Sale Notice for Sale of Immovable Assets under the Securitisation and Reconstruction of Financial Assets and Enforcement of Security Interest Act, 2002 read with proviso to Rule 8 (6) of the Security Interest (Enforcement) Rules, 2002.  
Notice is hereby given to the public in general and in particular to the Borrower (s) and Co-Borrower (s) as per column (ii) that the below described immovable properties as per column (iii) mortgaged/charged to the Secured Creditor, the physical possession of which has been taken by the Authorised Officer Formerly known as IDFC Bank Ltd now IDFC FIRST Bank Limited, will be sold on "As is where is", "As is what is", and "Whatever there is" on 21st Sept 2023 as described hereunder, for the recovery of amount due from Borrower (s) and Co-Borrower (s) as per column (i), due to IDFC FIRST Bank Limited (Formerly known as IDFC Bank Ltd).

S. NO	(i) Demand Notice Amount	(ii) Name Borrower (s) and Co-Borrower (s)	(iii) PROPERTY ADDRESS	(iv) Reserve Price Amount	(v) EMD Amount	(vi) Date and Time of Auction	(vii) Date and Time of EMD Auction	(viii) Date and Time of Inspection	(ix) Name and Mobile No of Authorized officer
1	INR 66,62,087.41/- Demand Notice Date: 01-Jun-2021	Swastika Shoes, Mr. Ketan Jaman Kanjiya & Mrs. Pratulaben K Kanjiya	Property-2-All That Right, Title And Interest Of Immovable Property, Premis Of Flat No. B/406 Admeasuring 66.264 Sq.Mtrs, Super Built Up Area & Admeasuring 38,410 Sq.Mtrs, Built Up Area, Alongwith Proportionate Undivided Land Share In Ground Land Admeasuring 19,250 Sq.Mtrs, Building No.B Fourth Floor, Sunrise, Developed Upon Land Situated In State: Gujarat, District: Surat, Sub District & Taluka: Choryasi, Moje: Deladva, Bearing Sheet No.6, Chalta No. 7, 100, 101, City Survey No.157, 438, 439 After Amalgamation New City Survey No.157, Totally Admeasuring 1155.26 Sq.Mtrs, Paikae. Bounded As Under:- North: Flat No.405, South: Ots, East: Ots & West: Passage/Flat No.407	INR 7,85,440/-	INR 78,544/-	21st Sept 2023 11.00 to 1.00 PM	20th Sept 2023	14th Sept 2023 11.00 to 5.00 PM	Name-Mr. Pratik Kapadiya MOB- 9227910846
			Property-3-All That Right, Title And Interest Of Immovable Property, Premis Of Flat No. B/404 Admeasuring 70.260 Sq.Mtrs, Super Built Up Area & Admeasuring 40,740 Sq.Mtrs, Built Up Area, Alongwith Proportionate Undivided Land Share In Ground Land Admeasuring 20,410 Sq.Mtrs/building No.B, Fourth Floor, Sunrise, Developed Upon Land Situated In State: Gujarat, District: Surat, Sub District & Taluka: Choryasi, Moje: Deladva, Bearing Sheet No.6, Chalta No.7, 100, 101, City Survey No. 157, 438, 439 After Amalgamation New City Survey No.157, Totally Admeasuring 1155.26 Sq.Mtrs, N.A Land Paikae, Bounded As Under:-East: Flat No: 407, West: Passage/ Stair, North: Flat No: 403 & South: Ots	INR 8,32,810/-	INR 83,281/-				

For detailed terms and conditions of the sale, please refer to the link provided in [www.idfcfirstbank.com](http://www.idfcfirstbank.com).  
Sd/-  
Authorised Officer  
IDFC FIRST Bank Limited  
(Formerly known as IDFC Bank Ltd)  
Date: 04.09.2023